



Prosperity


શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2017
OCTOBER

૧ ઓક્ટોબર, ૨૦૧૭

— તમસ —
— Inertia —

*With trust in the
Divine's Grace all
obstacles can be
surmounted*

with my blessings


With trust in the Divine's Grace all obstacles can be surmounted.

With my blessings
— The Mother

પ્રભુની કૃપામાં શ્રદ્ધા રાખીને બધી મુશ્કેલીઓ જીતી શકાય છે.
મારા આશીર્વાદ સાથે
— શ્રી માતાજી



15 August 1959: Installation of the painting of Sri Aurobindo by President Dr. Radhakrishnan in the Rashtrapathi Bhavan, New Delhi .

૧૫મી ઓગસ્ટ ૧૯૫૯ ના દિને, શ્રી અરવિંદની છબીની સ્થાપના, વાઈસપ્રેસિડન્ટ ડૉ. રાધાકૃષ્ણાનના હાથે, રાષ્ટ્રપતિ ભવન - ન્યૂ દિલ્હીમાં.

[બાલ દક્ષિણા - અંક ૪, નવેમ્બર ૧૯૫૯]

From:Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ©0413-2331470

રવાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી-૨. ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • October 2017

Mantras of the Mother - 20 April 1954 / શ્રી માતાજીના મંત્રો - ૨૦ એપ્રિલ ૧૯૫૪

The difficulty of the physical nature comes inevitably in the course of the development of the sadhana. Its obstruction, its inertia, its absence of aspiration or movement have to show themselves before they can be got rid of – otherwise it will always remain undetected, hampering even the best sadhana and preventing its completeness. This coming up of the physical nature lasts longer or less according to the circumstances, but there is none who does not go through it.

Inertia is a tremendous force – one of the biggest world-forces.

Inertia is the very character of the physical consciousness left to itself – it is accustomed to be passive to forces and to be their instrument or give a mechanical response to them.

Inertia is mental, vital, physical, subconscious. Physical inertia can produce mental inertia, mental inertia can produce physical inertia, vital inertia almost always makes the physical lifeless and lustreless and dull, and that is inertia. Vital inertia can also infect the mind, unless the mind is very strong and clear. I have always said that the physical consciousness is the main seat and source of inertia.

This inertia has to be cured by putting it into contact with the right forces from above. That is why I asked you to aspire for the higher wideness, purity and peace, so that that may occupy the physical and the true Force work instead of these invading ideas and impulses.

- Sri Aurobindo

સાધનામાં પ્રગતિના માર્ગે ભૌતિક પ્રકૃતિની મુશ્કેલી ક્યારેક ને ક્યારેક અવશ્ય આવે જ છે. એનો અવરોધ, એનું તમસ, એની અભીપ્સાનો અથવા ગતિનો અભાવ - આ બધાંએ પોતાનાં સ્વરૂપ બતાવવાં જ પડે છે, એમનો નિકાલ કરી શકાય એ પહેલાં. જો એમનો નિકાલ નથી થતો, તો એ તમારામાં સંતાયેલાં રહે છે અને ઉત્તમમાં ઉત્તમ સાધનામાં પણ અંતરાય નાખતાં રહે છે અને સાધનાની પૂર્ણતાની પ્રાપ્તિ રોકતાં રહે છે. ભૌતિક પ્રકૃતિનું સપાટી ઉપર આવવું અને દેખાવું, લાંબા કે ટૂંકા સમય માટે, એ સંજોગોની ઉપર આધાર રહે છે. પણ, આમાંથી પસાર થયા વિના કોઈ સાધક બાકી રહેતો નથી.

તમસ એક પ્રચંડ બળ છે - જગતના બળોમાંનું એક મોટામાં મોટું.

તમસ એ શરીરની ચેતનાનો સાહજિક મૂળ સ્વભાવ છે. એના ઉપર કોઈ અન્ય બળોની અસર ન પડે ત્યાં સુધી એ નિષ્ક્રિય પડી રહે છે. અને અસર પડે ત્યારે તે એ બળોનું માધ્યમ, કરણ બનવાને અથવા એમને એક યાંત્રિક પ્રત્યુત્તર આપવાને ટેવાયેલું છે.

તમસ મનનું, પ્રાણનું, શરીરનું અને અવચેતનનું હોય છે. શરીરનું તમસ મનનું તમસ ઊભું કરી શકે છે, અને મનનું તમસ શરીરનું તમસ ઊભું કરી શકે છે. પ્રાણનું તમસ લગભગ હમેશાં શરીરને શક્તિહીન નિસ્તેજ અને સુસ્ત બનાવે છે - તમસ તે આ છે. પ્રાણનું તમસ મનને પણ દુષિત કરી શકે છે, સિવાય કે મન ઘણું શક્તિશાળી હોય અને સ્પષ્ટ રીતે જાગૃત હોય. મેં હમેશાં કહ્યું છે કે તમસનું ઉદ્ભવ સ્થાન અને એની બેઠક પણ શરીરની ચેતનામાં છે.

તમસની આ અવસ્થા દૂર કરવા એને ઊર્ધ્વની સાચી શક્તિઓના સંપર્કમાં મૂકવું જોઈએ. એટલે મેં તમને ઊર્ધ્વની વિશાળતા, પવિત્રતા અને શાંતિ માટે અભીપ્સા કરવાનું કહ્યું કે જેથી એ ત્રણે શરીરમાં ગોઠવાઈ જાય અને આક્રમણ કરતા વિચારો અને આવેશોને સ્થાને એક સાચી શક્તિ કાર્ય કરી શકે.

- શ્રી અરવિન્દ